



eriktology

The Writings

Book of Proverbs

FOREWORD

It should be noted when using this workbook, that we (Eric, Lee, James, and a host of enthusiastic encouragers) are not making a statement that this version is perfect, nor is it a representation of the most accurate real copy of “Ha DBR YHUH” as written on Mt Sinai...
... although it just might indeed be.

The purpose of creating this workbook is simply so that those who are interested in studying the Word of YHUH from the perspective of Paleo Hebrew, have access to what is determined to be “the original words” - in the very ancient font composed by Eric Bissell ... known as “eriktology”.

In this collection of the first 5 Books of the TORAH : Bereshiyt / Genesis, Shemot / Exodus, Wayiqra / Leviticus, Bemidbar / Numbers, and Devariym / Deuteronomy- you can be guaranteed, that despite our great efforts to produce a flawless rendition here, there probably are mistakes. If you find one, please let us know so that it can be remedied for a future version.

Conversion process: As the base version of the script, we have used the online version of the Hebrew Bible: <http://www.ancient-hebrew.org/hebrewbible/0 index.html>

We then compared that to the Stone Edition TANACH for verification and comparison.
<http://www.artscroll.com/Books/9780899062693.html>

If you use a different version, you may find differences in the verse numberings or layout.

This is not a translation.

Space is provided between the lines of words for you, the Scholar, to write your own notes of meaning.

We believe that because the Ancient Paleo Hebrew Letters are “pictures”, simply looking at these letters will have some affect on seeing the words in a way never experienced by most Students of Scripture.

“Work out your own translation in awe and reverence”.

The understanding to be gained by exploring this text, has been found by many to be veritably “hyper-dimensional”... yet that is completely a product of your own effort.

We would like to thank all those who help support the eriktology study and ask that you spread the word. Go ahead and send this around.

This pdf file is free for distribution to anyone anywhere.

There are other writings and videos and graphics being produced by numerous people making use of this format. Have at it. Exalt Ha SHEM. Wake up Ephraim. TESHUVA.

This is just a beginning.

My “copyright” of this material demands that you “Copy it Right” as the Word deserves.

Thank you. c 2018

It occurred to me that when people try to translate the Torah with the eriktology fonts, and if they are not familiar with those fonts they may want to compare the Hebrew version in say the Stone Edition TANAK or some other Hebrew version, and make sure it is accurate. So below we have a chart that shows the English, Hebrew, eriktology fonts comparisons.

English	Hebrew	eriktology
ALEPH	א	a
BEIT	ב	b
GIMEL	ג	g
DALET	ד	d
HEI	ה	h
UAV	ו	v
ZAYIN	ז	z
CxET	ח	j
TET	ט	f
YOD	י	y
KAF	כ	k
FINAL KAF	ך	
LAMED	ל	l
MEM	מ	m
FINAL MEM	ם	
NOON	נ	n
FINAL NOON	ן	
SAMEK	ס	s
AYIN	ע	i
PEI	פ	p
FINAL PEI	ף	

TzADI	ר	x
FINAL TSADE	ר	
QOOF	פ	q
RESH	ר	r
ShIN	ו	c
TAV	ט	t

Proverbs 1

1 :ራዳዎሃን ማሪ ልሃላ-ክፍ ጃሚሪ ስሪሃን

2 :ጃክፍ ስግግር ክፍፍሪ ገጃሃን ጃሚሪ ጸጋሪ

3 :ሚሰጥሃን ጸጋሃን ስጋሃን ስጋሃን ስጋሃን ገጃሃን ጸጋሪ

4 :ጃሚሪ ጸጋሪ ገጃሃን ጃሚሪ ሚሰጥሃን ጸጋሪ

5 :ጃክፍ ጸጋሪ ገጃሃን ጃክፍ ገጃሃን ጃክፍ ገጃሃን

6 :ሚሰጥሃን ጃክፍ ገጃሃን ጃክፍ ገጃሃን ገጃሃን

7 :ሃገፍ ሚሰጥሃን ገጃሃን ጃክፍ ገጃሃን ገጃሃን ገጃሃን

8 :ሚሰጥሃን ገጃሃን ገጃሃን ገጃሃን ገጃሃን ገጃሃን

9 :ሚሰጥሃን ገጃሃን ገጃሃን ገጃሃን ገጃሃን ገጃሃን

:אַפּאָר-אַר טאַפּאַטאָפּאַ טאַפּאַפּאַ-אַר 10

:אַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ 11

:אַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ 12

:אַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ 13

:אַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ 14

:אַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ 15

:אַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ 16

:אַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ 17

:אַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ פּאַפּאַ 18

:ክፍቱ ሃይሎግ ሠጋ-ጸጸ ጦፍ ጦፍ-ረግ ጸሃክጸ ስግ 19

:ጸረሃፍ ስጸጸ ጸሃግግግ ጸፍግግ ጸሃግግ ጸሃግግግ 20

:ግግግግ ጸፍግግግ ግግግግ ግግግግ ግግግግ ግግግግ ግግግግ ግግግግ 21

:ጸግግ-ሃግግግግ ግግግግግግ ግግግ ሃግግግ ስግግግ ግግግግ ግግግግ ግግግግ ግግግግ-ግግግ 22

:ግግግግ ግግግግ ግግግግግግ ግግግግ ግግግግ ግግግግ ግግግግ ግግግግግግ ግግግግግግ 23

:ግግግግግ ስግግግ ግግግ ግግግግ ስግግግግ ግግግግግ ግግግግግ ግግግግ 24

:ግግግግግ ግግግ ግግግግግግ ግግግግግ-ረግ ሃግግግግግግ 25

:ግግግግግ ግግግ ግግግግ ግግግግ ግግግግግግ ግግግግግግ 26

ግግግግግ ግግግግግግ ግግግግግግ (ፍ ግግግግግ) [ግ ግግግግግ] ግግግ 27

:ግግግግግ ግግግ ግግግግግ ግግግ ግግግግግ

:ገንዘብን ልረጅ ገንዘብን ገንዘብ ልረጅ ገንዘብን ገንዘብ 28

:ሃይማኖት ልረጅ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ 29

:ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ 30

:ሃይማኖት ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ 31

:ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ 32

:ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ 33

Proverbs 2

:ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ 1

:ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ 2

:ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ 3

:ᐱᑦᐳᑦᑕᑦᐱ ᐳᑦᐱᑦᑕᑦᐳᑦ ᑕᑦᑕᑦᑕᑦ ᐱᑦᐳᑦᑕᑦᐱ-ᐳᑦ 4

:ᐱᑦᐳᑦ ᐳᑦᐱᑦᑕᑦ ᐱᑦᐳᑦ ᐱᑦᐳᑦ ᐱᑦᐳᑦ ᐱᑦᐳᑦ ᐱᑦᐳᑦ 5

:ᐱᑦᐳᑦᑕᑦᐱ ᐱᑦᐳᑦ ᐳᑦᐱᑦᑕᑦ ᐱᑦᐳᑦ ᐱᑦᐳᑦᑕᑦᐱ-ᐳᑦ 6

:ᐳᑦᐱᑦ ᐳᑦᐱᑦᑕᑦ ᐱᑦᐳᑦ ᐱᑦᐳᑦᑕᑦᐱ (ᐱ ᐱᑦᐳᑦ) [ᐳ ᐱᑦᐳᑦ] 7

:ᐱᑦᐳᑦ (ᐱ ᐳᑦᐱᑦᑕᑦᐱ) [ᐳ ᐳᑦᐱᑦᑕᑦᐱ] ᐳᑦᐱᑦᑕᑦᐱ ᑕᑦᑕᑦᑕᑦ ᐳᑦᐱᑦᑕᑦᐱ ᐱᑦᐳᑦ 8

:ᑕᑦᑕᑦᑕᑦᐱᑦᑕᑦᐱ ᐳᑦᐱᑦᑕᑦᐱᑦ ᐳᑦᐱᑦᑕᑦᐱ ᐱᑦᐳᑦ ᐱᑦᐳᑦ ᐱᑦᐳᑦ 9

:ᐳᑦᐱᑦ ᐳᑦᐱᑦᑕᑦ ᐱᑦᐳᑦ ᐳᑦᐱᑦᑕᑦ ᐱᑦᐳᑦ ᐱᑦᐳᑦᑕᑦᐱ-ᐳᑦ 10

:ᐳᑦᐱᑦᑕᑦᐱ ᐱᑦᐳᑦᑕᑦᐱ ᐳᑦᐱᑦᑕᑦ ᐱᑦᐳᑦᑕᑦᐱ 11

:ᐳᑦᐱᑦᑕᑦᐱ ᐱᑦᐳᑦᑕᑦᐱ ᐳᑦᐱᑦᑕᑦ ᐱᑦᐳᑦᑕᑦᐱ 12

- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21

Proverbs 3

1 ስራዎን ለጌታዎ ለገሰጡ ገንዘብ ለገሰጡ ስራዎን ለጌታዎ ለገሰጡ

2 ስራዎን ለጌታዎ ለገሰጡ ገንዘብ ለገሰጡ ስራዎን ለጌታዎ ለገሰጡ

3 ስራዎን ለጌታዎ ለገሰጡ ገንዘብ ለገሰጡ ስራዎን ለጌታዎ ለገሰጡ

4 ስራዎን ለጌታዎ ለገሰጡ ገንዘብ ለገሰጡ ስራዎን ለጌታዎ ለገሰጡ

5 ስራዎን ለጌታዎ ለገሰጡ ገንዘብ ለገሰጡ ስራዎን ለጌታዎ ለገሰጡ

6 ስራዎን ለጌታዎ ለገሰጡ ገንዘብ ለገሰጡ ስራዎን ለጌታዎ ለገሰጡ

7 ስራዎን ለጌታዎ ለገሰጡ ገንዘብ ለገሰጡ ስራዎን ለጌታዎ ለገሰጡ

8 ስራዎን ለጌታዎ ለገሰጡ ገንዘብ ለገሰጡ ስራዎን ለጌታዎ ለገሰጡ

:ህጻናት-ሆስፒታል ለሰው ጤና ማረጋገጫ ማድረግ 9

:ህጻናት ማረጋገጫ ለሰው ጤና ማረጋገጫ ማድረግ 10

:ህጻናት ማረጋገጫ ለሰው ጤና ማረጋገጫ ማድረግ 11

:ህጻናት ማረጋገጫ ለሰው ጤና ማረጋገጫ ማድረግ 12

:ህጻናት ማረጋገጫ ለሰው ጤና ማረጋገጫ ማድረግ 13

:ህጻናት ማረጋገጫ ለሰው ጤና ማረጋገጫ ማድረግ 14

:ህጻናት ማረጋገጫ ለሰው ጤና ማረጋገጫ ማድረግ 15

:ህጻናት ማረጋገጫ ለሰው ጤና ማረጋገጫ ማድረግ 16

:ህጻናት ማረጋገጫ ለሰው ጤና ማረጋገጫ ማድረግ 17

- 18 :9W&w 31wXy 39 w1p1fkwL &13 w11k-1o
- 19 :3ky9x9 w1w hkyw 19&-v#1 3wuw9 3y31
- 20 :o-yjo91 w1pkwY yop9h xywy3x yxov9
- 21 :3wkwY 31wx 91h w11k-w yf11-1& 1h9
- 22 :w1x999l hky wWjhl w11k y131y
- 23 :jyx &l w19y wuwv h99l wlx 9&
- 24 :wxw 399oy x9wWy vhwjx-&l 9wWX-w&
- 25 :&9x 1w w1ow9 x&wWy w&xj vhwjw &91x-1&
- 26 :vwlw w199 9wWy w1f1w9 3131 3y31-1w
- 27 :xywol (p wv1) [w w1v1] 1&l xy139 y1lo9w 9y8-owwX-1&

28 :שׁוֹרֵר וְיִשְׁתַּחֲוֶה אֲנִי לְפָנָיו (פ' שׁוֹרֵר) [שׁוֹרֵר] אֲנִי וְיִשְׁתַּחֲוֶה

29 :שׁוֹרֵר אֲנִי וְיִשְׁתַּחֲוֶה אֲנִי לְפָנָיו (פ' שׁוֹרֵר) [שׁוֹרֵר] אֲנִי וְיִשְׁתַּחֲוֶה

30 :שׁוֹרֵר אֲנִי וְיִשְׁתַּחֲוֶה אֲנִי לְפָנָיו (פ' שׁוֹרֵר) [שׁוֹרֵר] אֲנִי וְיִשְׁתַּחֲוֶה

31 :שׁוֹרֵר אֲנִי וְיִשְׁתַּחֲוֶה אֲנִי לְפָנָיו (פ' שׁוֹרֵר) [שׁוֹרֵר] אֲנִי וְיִשְׁתַּחֲוֶה

32 :שׁוֹרֵר אֲנִי וְיִשְׁתַּחֲוֶה אֲנִי לְפָנָיו (פ' שׁוֹרֵר) [שׁוֹרֵר] אֲנִי וְיִשְׁתַּחֲוֶה

33 :שׁוֹרֵר אֲנִי וְיִשְׁתַּחֲוֶה אֲנִי לְפָנָיו (פ' שׁוֹרֵר) [שׁוֹרֵר] אֲנִי וְיִשְׁתַּחֲוֶה

34 :שׁוֹרֵר אֲנִי וְיִשְׁתַּחֲוֶה אֲנִי לְפָנָיו (פ' שׁוֹרֵר) [שׁוֹרֵר] אֲנִי וְיִשְׁתַּחֲוֶה

35 :שׁוֹרֵר אֲנִי וְיִשְׁתַּחֲוֶה אֲנִי לְפָנָיו (פ' שׁוֹרֵר) [שׁוֹרֵר] אֲנִי וְיִשְׁתַּחֲוֶה

Proverbs 4

1 :ᐱᓕᓕᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ

2 :ᐱᓂᐱᓂᐱᓂᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ

3 :ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ

4 :ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ

5 :ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ

6 :ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ

7 :ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ

8 :ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ

9 :ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ

10 :ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ ᐱᓂᐱᓂ

- 11 :9W1-167099 9W1999 9W1999 9W1999 9W1999
- 12 :6W9X 6C 1999-9W1999 9W1999 9W1999 9W1999
- 13 :9W1999 9W1999 9W1999 9W1999 9W1999 9W1999
- 14 :9W1999 9W1999 9W1999 9W1999 9W1999 9W1999
- 15 :9W1999 9W1999 9W1999 9W1999 9W1999 9W1999
- 16 (:9W1999) [9W1999] 9W1999 9W1999 9W1999 9W1999 9W1999 9W1999
- 17 :9W1999 9W1999 9W1999 9W1999 9W1999 9W1999
- 18 :9W1999 9W1999 9W1999 9W1999 9W1999 9W1999
- 19 :9W1999 9W1999 9W1999 9W1999 9W1999 9W1999

20 :שנא-סא יאמאא אאאאאא יאאאאא

21 :אאאא אאאא אאא אאאאאא אאאאאא

22 :אאאא אאאאאא-אאאא אאאאאא אא אאאאאא-אאא

23 :אאאא אאאאאא אאאאאא-אאא אאא אאא אאאאאא-אאא

24 :אאא אאאא אאאא אאאאאא אא אאאאאא אאא אאא

25 :אאאא אאאאאא אאאאאאאא אאאאאא אאאא אאאאאא

26 :אאאא אאאאאא-אאאא אאאא אאאא אאאא

27 :אאאא אאאא אאאא אאאאאאאא אאאא-אאאא

Proverbs 5

1 :שנא-סא יאאאאאא אאאאאא אאאאאא

- 2 :ሃገራዊ ስነ-ምግባር ለማረጋገጥ ለሚያስፈልጉት ምርመራዎች
- 3 :ሰነድ ለማረጋገጥ የሚያስፈልጉት ሰነድ ለማረጋገጥ ለሚያስፈልጉት ሰነድ
- 4 :አሁን ያለውን ስነ-ምግባር ለማረጋገጥ ለሚያስፈልጉት ሰነድ
- 5 :ሰነድ ለማረጋገጥ ለሚያስፈልጉት ሰነድ ለማረጋገጥ ለሚያስፈልጉት ሰነድ
- 6 :ሰነድ ለማረጋገጥ ለሚያስፈልጉት ሰነድ ለማረጋገጥ ለሚያስፈልጉት ሰነድ
- 7 :ሰነድ ለማረጋገጥ ለሚያስፈልጉት ሰነድ ለማረጋገጥ ለሚያስፈልጉት ሰነድ
- 8 :ሰነድ ለማረጋገጥ ለሚያስፈልጉት ሰነድ ለማረጋገጥ ለሚያስፈልጉት ሰነድ
- 9 :ሰነድ ለማረጋገጥ ለሚያስፈልጉት ሰነድ ለማረጋገጥ ለሚያስፈልጉት ሰነድ
- 10 :ሰነድ ለማረጋገጥ ለሚያስፈልጉት ሰነድ ለማረጋገጥ ለሚያስፈልጉት ሰነድ

- 11 :שָׁמַעְתָּ שִׁשְׁבַּע יְמֵי שָׁמַעְתָּ שִׁשְׁבַּע יְמֵי שָׁמַעְתָּ
- 12 :לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְאַתָּה יְיָ אֱלֹהֵינוּ
- 13 :לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְאַתָּה יְיָ אֱלֹהֵינוּ
- 14 :שָׁמַעְתָּ שִׁשְׁבַּע יְמֵי שָׁמַעְתָּ שִׁשְׁבַּע יְמֵי שָׁמַעְתָּ
- 15 :שָׁמַעְתָּ שִׁשְׁבַּע יְמֵי שָׁמַעְתָּ שִׁשְׁבַּע יְמֵי שָׁמַעְתָּ
- 16 :שָׁמַעְתָּ שִׁשְׁבַּע יְמֵי שָׁמַעְתָּ שִׁשְׁבַּע יְמֵי שָׁמַעְתָּ
- 17 :שָׁמַעְתָּ שִׁשְׁבַּע יְמֵי שָׁמַעְתָּ שִׁשְׁבַּע יְמֵי שָׁמַעְתָּ
- 18 :שָׁמַעְתָּ שִׁשְׁבַּע יְמֵי שָׁמַעְתָּ שִׁשְׁבַּע יְמֵי שָׁמַעְתָּ
- 19 :שָׁמַעְתָּ שִׁשְׁבַּע יְמֵי שָׁמַעְתָּ שִׁשְׁבַּע יְמֵי שָׁמַעְתָּ

ᐱᑦᑭᑦᑭᑦ ᑦᑭ ᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦ 20

ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ-ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ 21

ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ 22

ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ 23

Proverbs 6

ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ 1

ᐱᑦᑭᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ 2

ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ 3

ᐱᑦᑭᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ 4

ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ 5

6 :טשקע זעלבשטענדיג זענען זיינע זעלבשטענדיג-זעלבשטענדיג

7 :לעבן פון אים זענען זעלבשטענדיג פון זעלבשטענדיג

8 :זעלבשטענדיג פון זעלבשטענדיג זענען זעלבשטענדיג פון זעלבשטענדיג

9 :זעלבשטענדיג פון זעלבשטענדיג זענען זעלבשטענדיג פון זעלבשטענדיג

10 :פון זעלבשטענדיג פון זעלבשטענדיג זענען זעלבשטענדיג פון זעלבשטענדיג

11 :זעלבשטענדיג פון זעלבשטענדיג זענען זעלבשטענדיג פון זעלבשטענדיג

12 :זעלבשטענדיג פון זעלבשטענדיג זענען זעלבשטענדיג פון זעלבשטענדיג

13 :זעלבשטענדיג פון זעלבשטענדיג זענען זעלבשטענדיג פון זעלבשטענדיג

14 :זעלבשטענדיג (פון זעלבשטענדיג) [זעלבשטענדיג] זענען זעלבשטענדיג פון זעלבשטענדיג

:ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᑭᑦᑭᑦᑭᑦ-ᑭᑦᑭᑦ ᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦ-ᑭᑦ 25

:ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ 26

:ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ 27

:ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ-ᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ 28

:ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ-ᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ 29

:ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ-ᑭᑦ 30

:ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ-ᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ 31

:ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ 32

:ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ ᐃᑦᑭᑦᑭᑦᑭᑦ-ᑭᑦ 33

:ኃገኝ ኃሃቲፍ ሮሃኃቲ-ጵሮሃ ፃፃገ-አኃቲ ጻጵኃፃ-ቲፃ 34

:ፕቱፕ-ፃፃፃፀ ቲፃ ፃፃጵቲ-ጵሮሃ ፃፃፃፃ-ሮፃ ቲፃፃ ጵፕፃ-ጵሮ 35

Proverbs 7

:ሀሀጵ ኃፃፀፀ ቲፃሃፀፀፀ ቲፃፀፀ ፃፀፀፀ ቲፃፀፀ 1

:ሀፀፀፀፀ ኃሃፕፀፀፀ ቲፃፃፃፃፃ ፃፀፀፀ ቲፃሃፀፀ ፃፀፀፀ 2

:ሀፀፀ ፀሃሮ-ሮፀ ፀፃፀፀ ሀፀፀፀፀ-ሮፀ ፀፃፀፀ 3

:ጵፃፃፀ ፃፀፀፀፀ ፀፀፀፀ ጵፀፀ ቲፃፀፀ ፃፀፀፀፀ ፃፀፀፀ 4

:ፃፃፀፀፀፀ ፃፀፀፀፀ ፃፀፀፀፀፀ ፃፃፀ ፃፀፀፀ ሀፀፀፀፀፀ 5

:ቲፀፀፀፀፀፀ ቲፃፀፀፀ ፕፀፀ ቲፀፀፀ ፀሃፀፀፀ ቲፀፀ 6

:ፀፀፀ-ፃፀፀ ፃፀፀ ፀፀፀፀፀ ፃፀፀፀፀ ፀፀፀፀፀፀ ጵፃፀፀፀ 7

8 ማህበራዊ ጥበቃ ለማረጋገጥ የሚያስፈልጉትን ጥረት ያድርጉ

9 ለሥራዎቹ ለማስፈጸም የሚያስፈልጉትን ጥረት ያድርጉ

10 ለሥራዎቹ ለማስፈጸም የሚያስፈልጉትን ጥረት ያድርጉ

11 ለሥራዎቹ ለማስፈጸም የሚያስፈልጉትን ጥረት ያድርጉ

12 ለሥራዎቹ ለማስፈጸም የሚያስፈልጉትን ጥረት ያድርጉ

13 ለሥራዎቹ ለማስፈጸም የሚያስፈልጉትን ጥረት ያድርጉ

14 ለሥራዎቹ ለማስፈጸም የሚያስፈልጉትን ጥረት ያድርጉ

15 ለሥራዎቹ ለማስፈጸም የሚያስፈልጉትን ጥረት ያድርጉ

16 ለሥራዎቹ ለማስፈጸም የሚያስፈልጉትን ጥረት ያድርጉ

17 :ከሥራ ላይ ለመመለስ ለሚችሉ ግለሰቦች ማስገባት

18 :ግለሰቦችን ለማሳደድ ለሚችሉ ግለሰቦች ማስገባት

19 :የሥራ ላይ ለመመለስ ለሚችሉ ግለሰቦች ማስገባት

20 :የሥራ ላይ ለመመለስ ለሚችሉ ግለሰቦች ማስገባት

21 :የሥራ ላይ ለመመለስ ለሚችሉ ግለሰቦች ማስገባት

22 :የሥራ ላይ ለመመለስ ለሚችሉ ግለሰቦች ማስገባት

23 :የሥራ ላይ ለመመለስ ለሚችሉ ግለሰቦች ማስገባት

24 :የሥራ ላይ ለመመለስ ለሚችሉ ግለሰቦች ማስገባት

25 :የሥራ ላይ ለመመለስ ለሚችሉ ግለሰቦች ማስገባት

26 :የሥራ ላይ ለመመለስ ለሚችሉ ግለሰቦች ማስገባት

27 ገጽ 1 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ ለገጽ 27 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ

Proverbs 8

1 ገጽ 1 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ ለገጽ 1 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ

2 ገጽ 2 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ ለገጽ 2 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ

3 ገጽ 3 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ ለገጽ 3 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ

4 ገጽ 4 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ ለገጽ 4 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ

5 ገጽ 5 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ ለገጽ 5 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ

6 ገጽ 6 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ ለገጽ 6 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ

7 ገጽ 7 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ ለገጽ 7 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ

8 ገጽ 8 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ ለገጽ 8 ላይ ጻፈው የሚገኝ ማህተም-ገጽ

:ᐃᑭᑦᐅᑦᐅ ᑭᐱᓐ ስሃᐃ ፎᐱᐱ ᐅሂᑭሂ-ᑭᐱᓐ	18
:ᑭᐱᑭ ᐅᐃᓂᓂ ፎᐱᐱሂᑭᐱ ᑦᐅᓂᓂ ᑦሂᑭᐱᓂ ፎᐱᑭ ᑭሂᑭ	19
:ᑭᐅᓂᓂ ᐱሂᑭᐱᐱ ᓂሂᐱᑭ ᓂᓐᐃᐱ ᐃᑭᑦᐅ-ᐱᑭᐱᑭ	20
:ᐱᓐᓂᐱ ᓂᐃፎᐱᑭᐱ ᐱᑭ ፆᑭᐱ ᓐᐃᐱᐱᓐ	21
:ᑦᐱᓂ ሂᓐᓐᓐᓐ ᓂᐅᑭ ሂᓂᑭᐅ ᐱፎᐱᑭ ፆᐱᑭ ᐃሂᐃፆ	22
:ᑦᑭᐱ-ፎᐱᐅᑭᐱ ᐱᐱᑭᐱ ፆᐱᓂᐃ ᓂᓐᓐᓐ	23
:ᓂፆᐱ-ፆᐅᑭᐱ ᐱሂᐱᓐᓐ ስፆᐱᑭ ፆᐱᓐᓐ ᐱሂᓂᐃᐱ-ስፆᐱᑭ	24
:ፆᐱᓐᓐ ᐱሂᓐᑭ ፆᐱᓐ ሂᓐᑭᑭᐱ ᓂፆᐱᑭ ᓂᑭᑭ	25
:ᓐᑭ ᐱሂᑭᐅᓐ ᐱᐱᑭᐱ ᐱሂᑦᐱᑭ ᑦᑭᐱ ᐃᐱᓐ ᐱᓐᐅᓐ	26

:ሕሃጻን የክጋ-ሪዕ ገሃዳ ሃዋሃዳ የክጋ ሕወ ሕገሕ ሃክረሕገ	27
: ሕሃጻን ጸሃክሪዕ ሃሃሃዕ ሪዕሕ ሕገዋወ ሃሕሕ	28
:ሶጻ ገገገሃሕ ሃዋሃዳ ሃክጋ-ሃገገዕ ጸሪ ሕገሕ ሃዋዳ ሕገሪ ሃሕሂወገ	29
:ጸሪ-ሪሕገ ሃክክጋሪ ጸዋዋሕ ሕሃክ ሕሃክ ሕገወወ ጻጻጻሃ ሃሂሕ ሃሪሶ ጻጻጻሃ	30
:ሕገጸ ገገገ-ጸጸ ገወወወሃ ሃሶጻ ሪገገ ጸዋዋሕ	31
:ሃገገሕ ገገገ ገገገ ገገገ ገገ-ሃወሕ ሕገገ ጻጸዕ	32
:ሃወገገ-ሪሂ ሃሕሕ ገገገ ሃወሕ	33
:ገገገ ጸዋዋሕ ገገገ ሕገገ ሕገገ ገገገ-ሪዕ ገገገ ገገ ሕገ ሕገ ገገገ ገገገ	34
:ጻጻጻ ሃሂሂ ገገገ (ገ ጸሕ) [ሕ ገገገ] ገገገ ገገ	35
:ጸሕ ሃገገ ገገገ-ሕ ሃገገ ገገገ ገገገ	36

Proverbs 9

:ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ 1

:ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ 2

:ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ 3

:ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ 4

:ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ 5

:ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ 6

:ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ 7

:ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ 8

:ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ ጻጵጵ 9

- :ᐃᓕᓚᑦ ᓂᓚᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ
10
- :ᓂᓚᓚᓂᑦ ᐃᓂᓂᓂᑦ ᓂᓂ ᓂᓂᓂᓂᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ
11
- :ᐃᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ ᓂᓂ ᐃᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ
12
- :ᐃᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ-ᓂᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ
13
- :ᐃᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ-ᓂᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ
14
- :ᓂᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ-ᓂᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ
15
- :ᓂᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ
16
- :ᓂᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ ᐃᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ
17
- :ᐃᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ ᓂᓂᓂᓂᑦ
18

Proverbs 10

1 :ሃሳብ ጸገሃል ለታዘዘ ክፍሉ ልሳን-ክፍሉ ማህል ክፍ ጋ ገሳሪ ለሆነ

2 :አሃሳዊ ለታዘዘ ገሳሪ ልሳን ገሳሪ ለሆነ ለሆነ-አሳሪ

3 :ጋላሳ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ-አሳሪ

4 :ገሳሪ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ

5 :ሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ

6 :ሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ

7 :ገሳሪ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ

8 :ገሳሪ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ

9 :ገሳሪ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ ለሆነ

- :ፀግሮኑ ማጠጋገሚያ ስራዎች ለማጠናቀቅ 10
- :ጥራት ማረጋገጫ ስራዎች ለማጠናቀቅ 11
- :ጥራት ማረጋገጫ ስራዎች-ሆስፒታል ስራዎች ለማጠናቀቅ 12
- :ጥራት ማረጋገጫ ስራዎች ለማጠናቀቅ 13
- :ጥራት ማረጋገጫ ስራዎች ለማጠናቀቅ 14
- :ጥራት ማረጋገጫ ስራዎች ለማጠናቀቅ 15
- :ጥራት ማረጋገጫ ስራዎች ለማጠናቀቅ 16
- :ጥራት ማረጋገጫ ስራዎች ለማጠናቀቅ 17
- :ጥራት ማረጋገጫ ስራዎች ለማጠናቀቅ 18

:ጠቅላይ ሚኒስትር ለግብርና ጋራ ጉዞ ለማድረግ ያደረጉ ስራዎች 19

:ጠቅላይ ሚኒስትር ለግብርና ጋራ ጉዞ ለማድረግ ያደረጉ ስራዎች 20

:ሚኒስትሮች ጋራ ጉዞ ለማድረግ ያደረጉ ስራዎች 21

:ጠቅላይ ሚኒስትር ለግብርና ጋራ ጉዞ ለማድረግ ያደረጉ ስራዎች 22

:ጠቅላይ ሚኒስትር ለግብርና ጋራ ጉዞ ለማድረግ ያደረጉ ስራዎች 23

:ጠቅላይ ሚኒስትር ለግብርና ጋራ ጉዞ ለማድረግ ያደረጉ ስራዎች 24

:ጠቅላይ ሚኒስትር ለግብርና ጋራ ጉዞ ለማድረግ ያደረጉ ስራዎች 25

:ጠቅላይ ሚኒስትር ለግብርና ጋራ ጉዞ ለማድረግ ያደረጉ ስራዎች 26

:ጠቅላይ ሚኒስትር ለግብርና ጋራ ጉዞ ለማድረግ ያደረጉ ስራዎች 27

:ጠቅላይ ሚኒስትር ለግብርና ጋራ ጉዞ ለማድረግ ያደረጉ ስራዎች 28

29 :ካላ ስራ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ

30 :ገደብ-ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ

31 :ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ

32 :ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ

Proverbs 11

1 :ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ

2 :ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ

3 :ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ

4 :ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ

፡ጭፃ ርጋ፣ ሃጸጭፃፃ ሃፃፃፅ ፃፃፃጸ ፃፃፃጸ ጸፃፃፃ 5

፡ሃፅፃፃ ፃፃፃፃፃ ጸፃፃፃ ፃፃፃፃፃ ፃፃፃፃፃ ጸፃፃፃ 6

፡ፃፅፃፃ ፃፃፃፃ ጸፃፃፃፃ ፃፃፃፃ ፅፃፃፃ ጭፃ ፃፃፃ ጸፃፃፃ 7

፡ሃፃፃፃ ጭፃ ጸፃፃ ጸፃፃፃ ፃፃፃፃ ፃፃፃፃ ፃፃፃፃ 8

፡ሃፃፃፃ ፃፃፃፃፃ ጸፃፃፃፃ ሃፃፃፃ ጸፃፃፃ ፃፃፃፃ ፃፃፃፃ 9

፡ፃፃፃ ፃፃፃፃ ፃፃፃፃፃ ፃፃፃፃ ፃፃፃፃ ፃፃፃፃፃ ፃፃፃፃፃ ፃፃፃፃፃ 10

፡ፃፃፃፃ ፃፃፃፃፃ ፃፃፃፃ ጸፃፃ ፃፃፃፃ ፃፃፃፃፃ ጸፃፃፃፃ 11

፡ፃፃፃፃፃ ጸፃፃፃፃፃ ፃፃፃፃ ፃፃፃፃፃ ፃፃፃፃፃ ፃፃፃፃፃፃፃ 12

፡ፃፃፃ ፃፃፃፃፃ ፃፃፃፃፃፃፃ ፃፃፃፃፃፃፃ ፃፃፃፃፃፃፃ ፃፃፃፃፃፃፃ 13

፡ፃፃፃፃ ፃፃፃ ፃፃፃፃፃፃፃ ፃፃፃፃፃፃ ጸፃፃፃፃፃፃ ፃፃፃፃፃፃፃ 14

- 15 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ
- 16 :ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ
- 17 :ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ
- 18 :ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ
- 19 :ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ
- 20 :ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ
- 21 :ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ
- 22 :ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ
- 23 :ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ

24 :9Y#K~L-~X 9W1~ ~WYBY VY~ JFYHY 99J~ W1

25 :X9Y1 X~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~

26 :919W~ W&9L ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~

27 :Y&Y9X ~Y~ W9VY HY~ W991 9Y~ 9KW

28 :YK9J1 ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~

29 :9L-~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~

30 :~Y~ XYWJH KPY ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~

31 :X~YBY ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~ ~Y~

Proverbs 12

1 :9~9 XBYX X~WY X~V 9~X 9FY~ 9~X

:ግብርና ገቢዎችን ወደፊት ለማረጋገጥ ማድረግ ይቻላል

2

:ግብርና ገቢዎችን ወደፊት ለማረጋገጥ ማድረግ ይቻላል

3

:ግብርና ገቢዎችን ወደፊት ለማረጋገጥ ማድረግ ይቻላል

4

:ግብርና ገቢዎችን ወደፊት ለማረጋገጥ ማድረግ ይቻላል

5

:ግብርና ገቢዎችን ወደፊት ለማረጋገጥ ማድረግ ይቻላል

6

:ግብርና ገቢዎችን ወደፊት ለማረጋገጥ ማድረግ ይቻላል

7

:ግብርና ገቢዎችን ወደፊት ለማረጋገጥ ማድረግ ይቻላል

8

:ግብርና ገቢዎችን ወደፊት ለማረጋገጥ ማድረግ ይቻላል

9

:ግብርና ገቢዎችን ወደፊት ለማረጋገጥ ማድረግ ይቻላል

10

- 11 :ግራ-ጻፏት ማሰባሰብ ጋራ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ
- 12 :አንድ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ
- 13 :ግራ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ
- 14 :ሆኖ (ግ ግራ) [ግ ግራ] ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ
- 15 :ሆኖ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ
- 16 :ሆኖ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ
- 17 :ሆኖ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ
- 18 :አንድ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ
- 19 :ሆኖ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ ማሰባሰብ

Proverbs 13

ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦ-ᐱᑦ ᐱᑦᑭᑦ ᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ 1

ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ-ᐱᑦ ᐱᑦᑭᑦ 2

ᐱᑦᑭᑦ-ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ 3

ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ 4

ᐱᑦᑭᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ 5

ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ 6

ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ 7

ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ-ᐱᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ-ᐱᑦ ᐱᑦᑭᑦ 8

ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦ ᐱᑦᑭᑦᑭᑦ-ᐱᑦᑭᑦ 9

:ጋግግ ገሃቶ ማረረቶግ ጸጋጋጸጸ ሠጋጋጋ ጋጋጋጋ ጋጋጋጋ ጋጋጋጋ 19

:ጋጋጋጋ ማረረቶግ ጋጋጋጋ (ጋ ማረረቶጋ) [ጋ ማረረቶጋ] ማረረቶጋ-ጋጋጋ (ጋ ማረረቶጋ) [ጋ ማረረቶጋ] 20

:ጋጋጋጋ-ጋጋጋጋ ማረረቶጋጋጋ-ጋጋጋጋ ጋጋጋጋ ጋጋጋጋ ማረረቶጋጋጋ 21

:ጋጋጋጋ ማረረቶጋ ጋጋጋጋጋ ማረረቶጋጋጋ ማረረቶጋጋጋ ማረረቶጋጋጋ ጋጋጋጋ 22

:ጋጋጋጋ ጋጋጋጋ ጋጋጋጋ ማረረቶጋጋጋ ጋጋጋጋ ጋጋጋጋ ጋጋጋጋ 23

:ጋጋጋጋ ማረረቶጋ ጋጋጋጋ ጋጋጋጋ ጋጋጋጋ ጋጋጋጋ ጋጋጋጋ 24

:ጋጋጋጋ ማረረቶጋጋጋ ጋጋጋጋ ጋጋጋጋ ጋጋጋጋ ጋጋጋጋ ጋጋጋጋ 25

Proverbs 14

:ጋጋጋጋጋጋ ጋጋጋጋጋጋ ጋጋጋጋጋጋ ጋጋጋጋጋጋ ጋጋጋጋጋጋ ጋጋጋጋጋጋ 1

:ጋጋጋጋጋጋ ጋጋጋጋጋጋ ጋጋጋጋጋጋ ጋጋጋጋጋጋ ጋጋጋጋጋጋ ጋጋጋጋጋጋ 2

:ᐃᑦᑦᑦᑦᑦᑦ ᐃᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ 3

:ᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ 4

:ᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ 5

:ᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ 6

:ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ 7

:ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ 8

:ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ 9

:ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ 10

:ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦᑦ 11

:ግሃጵ ገሠገሥ ጸሓፊ ልብ ገሠገሥ ሃገራዊ-ጸሓፊ 22

:ግሃገሥ-ገሠገሥ ገሠገሥ-ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ 23

:ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ 24

:ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ 25

:ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ 26

:ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ 27

:ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ 28

:ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ 29

:ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ ገሠገሥ 30

:ካህንነት ለሌሎች ማህበራዊ ጥቅም ላይ ማውሰድ 31

:የሌሎች ጥቅም ላይ ማውሰድ ለሌሎች ጥቅም ላይ ማውሰድ 32

:ሌሎች ለሌሎች ጥቅም ላይ ማውሰድ ለሌሎች ጥቅም ላይ ማውሰድ 33

:አንድ ለሌሎች ጥቅም ላይ ማውሰድ ለሌሎች ጥቅም ላይ ማውሰድ 34

:ሌሎች ለሌሎች ጥቅም ላይ ማውሰድ ለሌሎች ጥቅም ላይ ማውሰድ 35

Proverbs 15

:ገራ-ገራ ለሌሎች ጥቅም ላይ ማውሰድ ለሌሎች ጥቅም ላይ ማውሰድ 1

:አንድ ለሌሎች ጥቅም ላይ ማውሰድ ለሌሎች ጥቅም ላይ ማውሰድ 2

: ሌሎች ለሌሎች ጥቅም ላይ ማውሰድ ለሌሎች ጥቅም ላይ ማውሰድ 3

:ካህንነት ለሌሎች ጥቅም ላይ ማውሰድ ለሌሎች ጥቅም ላይ ማውሰድ 4

- 5 :ኃጻጽ ጸክሮች ለግሥት ሃይማኖት ለግሥት ግሥት ግሥት ግሥት
- 6 :ጸክሮች ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት
- 7 :ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት
- 8 :ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት
- 9 :ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት
- 10 :ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት
- 11 :ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት
- 12 :ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት
- 13 :ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት
- 14 :ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት ግሥት

:ᐃᑦᑎᑦᑎᑦ ᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ	15
:ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ	16
:ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ	17
:ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ	18
:ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ	19
:ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ	20
:ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ	21
:ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ	22
:ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ ᑎᑦᑎᑦᑎᑦ	23

:ጃጳጵ ርሃጵጠጵ ሞሃቹ ካጋጠጠ ርገጠጠጠጠ ጃጠጠጠ ጠገገገገ ገገገገ 24

:ጃጠጠጠ ርሃገገ ሞገገገ ጃገገገ ገገገገ ጠገገገገ ጠገገገገ 25

:ጠገገገገ-ገገገገገገ ጠገገገገገገ ጠገገገገ ጠገገገገ ጠገገገገ ጠገገገገ 26

:ጠገገገገ ጠገገገገ ጠገገገገገገ ጠገገገገ ጠገገገገ ጠገገገገ 27

:ጠገገገገ ጠገገገገ ጠገገገገገገ ጠገገገገ ጠገገገገ ጠገገገገ 28

:ጠገገገገ ጠገገገገገገ ጠገገገገገገ ጠገገገገገገ ጠገገገገገገ 29

:ጠገገገገ-ጠገገገገገገ ጠገገገገገገ ጠገገገገገገ ጠገገገገገገ ጠገገገገገገ 30

:ጠገገገገ ጠገገገገገገ ጠገገገገገገ ጠገገገገገገ ጠገገገገገገ 31

:ጠገገገገ ጠገገገገገገ ጠገገገገገገ ጠገገገገገገ ጠገገገገገገ 32

Proverbs 16

:ክሃሠሪ ጃክጐግ ጃሃጃገግሃ ምሪ-ገግግጐግ ግጋጵሪ

1

:ጃሃጃገ ጸሃጃሃ ምግግ ሃገገገጐግ ግግ ሠገጵ-ገግግጐግ-ግግ

2

:ግገግግግግ ሃገግገገ ግገግጐግ ጃሃጃገ-ጵ ገገ

3

:ጃጐግ ግሃገሪ ጐሠግ-ግገሃ ሃጃክጐግ ጃሃጃገ ጐጋ ግግ

4

:ጃግገገ ጵሪ ልሪ ልገ ምሪ-ጃግገ-ግግ ጃሃጃገ ጸግጐግግ

5

:ጐግግ ሞግገ ጃሃጃገ ጸጵሞገግ ምጐግ ሞግግ ጸግጵሃ ልጃጃግ

6

:ሃጸጵ ግሪሠገ ሃገግገገጐግ-ግገ ሠገጵ-ገግግጐግ ጃሃጃገ ጸሃገግግ

7

:ጐጋግግ ጵሪግ ጸሃጵሃግግ ምግግ ጃግግጐግ ጐጐግ-ግግጐግ

8

:ሂገጽ ክፍል ጸሐፊ ስም ስም	9
:ሂገጽ-ጽሑፍ ስም ስም	10
:ስም-ጽሑፍ-ስም ስም ስም ስም ስም	11
:ስም ስም ስም ስም ስም ስም ስም ስም	12
:ስም ስም ስም ስም ስም ስም ስም ስም	13
:ስም ስም ስም ስም ስም ስም ስም ስም	14
:ስም ስም ስም ስም ስም ስም ስም ስም	15
:ስም ስም ስም ስም ስም ስም ስም ስም	16
:ስም ስም ስም ስም ስም ስም ስም ስም	17

:ጋሃረጵ ልብገጋ ስገገህ ስሃገግ ስረገገ ጸሃገገ ጸሃገገ ጸሃገገ 28

:ግሃግ-ጸረ ማገገ ሃገገገገ ሃገገገ ሃገገገ ሃገገገ ሃገገገ 29

:ጸገገ ጸሃገ ሃገገገ ስገገ ጸሃገገገ ጸሃገገ ጸሃገገ ጸሃገገ 30

:ጸሃገገ ጸሃገገ ማገገ ጸሃገገ ጸሃገገ ጸሃገገ ጸሃገገ 31

:ጸሃገገ ልብገጋ ሃገገገገ ማገገገ ጸሃገገገ ማገገገ ማገገገ ጸሃገገ 32

:ሃገገገገ-ጸሃ ጸሃገገገገ ማገገገገ-ጸሃ ማገገገ ጸሃገገገ 33

Proverbs 17

:ጸሃገገ-ጸሃገገ ጸሃገገ ጸሃገገ ጸሃገገ ጸሃገገ ጸሃገገ 1

:ጸሃገገ ጸሃገገ ጸሃገገ ጸሃገገ ጸሃገገ ጸሃገገ ጸሃገገ 2

3 :ᐃᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ

4 :ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ-ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ-ᑦᑦᑦᑦ-ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ

5 :ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ

6 :ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ

7 :ᑦᑦᑦᑦ-ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ-ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ-ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ-ᑦᑦᑦᑦ

8 :ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦ-ᑦᑦᑦᑦ-ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ

9 :ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ

10 :ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ

11 :ᑦᑦᑦᑦ-ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ

12 :ᑦᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ-ᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ ᑦᑦᑦᑦᑦ

13 :YX19ግ ጻጋጋ (ገ WYግX) [ግ W1ግX] -ጵረ ጻጋጋጋ XጵX ጻጋጋ ገ1Wግ

14 :WYጋጵ ገ1ገጻ ጋረገXጻ 1ጵጋረY ጵYጎግ X1Wጵገ ግ1ግ ገጋYጋ

15 :ግጻ1ጵW-ግገ ጻYጻጻ XገጋYX ገ1ጎገ ጋ1WገግY ጋWገ ገ1ጎገግ

16 :ጵጵ-ገረY ጻግግጵ XYጵገረ ገ1ጻግ-ጎ1ገ ገ1ጵግ ጻጎ-ጻግረ

17 :ጎረY1 ጻገረ ጵጵY ጋገጻ ገጻጵ Xጋ-ግግ

18 :Yጻጋገ 1ጵጋ ጻገጋጋ ገገጋ ጋግ ጋገYX ገረ-ገጻጵ ግጎጵ

19 :ገገW-Wገገግ YጵXጋ ጻ1ገገግ ጻጎግ ገጻጵ ጋWጋ ገጻጵ

20 :ጻጋገገ ጋጋ1 YጵYWጋገ ግጋጻጵ ገYጋ-ጵጎግ1 ጵረ ገረ-Wገጋ

21 :ገገ 1ገጵ ጵግW1-ጵረY Yረ ጻገYXረ ገ1ጻግ ጎረ1

22 :ግገገ-WገገX ጻጵግጵ ጵYገY ጻጻገ ገጋ1ገ ጵግ ገረ

:ጸጋወኝ ጸሃዳጻ ጸሃጸጻ ጽዋጊ ጠወጻ ገጊዳኝ ልዳወ 23

:ገጻ-ጻገገ ርገገ ገገገ ገገገ ገገገ ገገገ ገገገ ገገገ 24

:ሃጸገገገ ገገገ ገገገ ገገገ ገገገ ገገገ ገገገ 25

:ገገገ-ገገ ገገገገገ ገገገገገ ገገገገገ ገገገገገ ገገገገገ ገገገገገ 26

:ገገገገገ ገገገገገ (ገ ገገገ-ገገገ) [ገገገ -ገገገ] ገገገገ ገገገገ ገገገገገ ገገገገገ 27

:ገገገገ ገገገገገ ገገገገገ ገገገገገ ገገገገገ ገገገገገ ገገገገገ 28

Proverbs 18

:ገገገገ ገገገገገ-ገገገ ገገገገ ገገገገ ገገገገ ገገገገ 1

:ገገገ ገገገገገገገ-ገገገ ገገገ ገገገገገገ ገገገገገ ገገገገገገ 2

:ገገገገ ገገገገገ-ገገገ ገገገገገ ገገገገ ገገገገ ገገገገገ 3

:ᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃ ᐃᐃᐃ ᐃᐃᐃ ᐃᐃᐃ-ᐃᐃᐃ ᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃ 4

:ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ 5

:ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ 6

:ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃ 7

:ᐃᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ 8

:ᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃ 9

:ᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃᐃᐃ 10

:ᐃᐃᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃᐃᐃ 11

:ᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃᐃᐃ ᐃᐃᐃᐃᐃᐃᐃᐃᐃᐃ 12

- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22

:Xሃፍጐ ጃካጐጐ ሰገገጐጐ ሠገገጐጐ ሠገገጐጐ ሠገገጐጐ 23

:ቁጵሕ ሰገገጐ ሰገገጐ ሠገገጐ ጐጐጐጐ ሠገገጐ ሠገገጐ 24

Proverbs 19

:ገገጐጐ ጵሃጐጐ ሃገጐጐ ሠገገጐጐ ሃገጐጐ ሠገገጐጐ ሠገገጐጐ ሠገገጐጐ 1

:ጵጐጐጐ ሠገገጐጐ ሰገገጐ ሰገገጐ-ጵጐ ሠገገጐ ጵጐጐ ጵጐጐ-ጵጐ ሠገገጐ 2

:ሃገጐ ጐጐጐጐ ጵሃጐጐ-ጐጐ ሃገጐጐ ጐጐጐ ሠገገጐ ጵጐጐ ጵጐጐ 3

:ጵጐጐጐ ሃገጐጐጐ ጐጐ ሠገገጐጐ ሠገገጐጐ ጐጐጐጐ ጵጐጐ 4

:ጐጐጐ ጵጐ ሠገገጐጐ ጵጐጐጐ ጵጐጐጐ ጵጐ ሠገገጐጐ ጵጐ 5

:ጵጐ ሠገገጐ ጐጐጐ-ጐጐ ሰገገጐጐ-ጐጐ ሃገጐጐ ሠገገጐጐ 6

7 ስራ ላይ የሚገኙት ሰራተኞች የሥራ ስልጠና ላይ ለማግኘት ይገባቸዋል።

(ሥራ-ላይ) [ሥራ - ስራ] ስራ ላይ

8 ስራ ላይ የሚገኙት ሰራተኞች የሥራ ስልጠና ላይ ለማግኘት ይገባቸዋል።

9 ስራ ላይ የሚገኙት ሰራተኞች የሥራ ስልጠና ላይ ለማግኘት ይገባቸዋል።

10 ስራ ላይ የሚገኙት ሰራተኞች የሥራ ስልጠና ላይ ለማግኘት ይገባቸዋል።

11 ስራ ላይ የሚገኙት ሰራተኞች የሥራ ስልጠና ላይ ለማግኘት ይገባቸዋል።

12 ስራ ላይ የሚገኙት ሰራተኞች የሥራ ስልጠና ላይ ለማግኘት ይገባቸዋል።

13 ስራ ላይ የሚገኙት ሰራተኞች የሥራ ስልጠና ላይ ለማግኘት ይገባቸዋል።

14 ስራ ላይ የሚገኙት ሰራተኞች የሥራ ስልጠና ላይ ለማግኘት ይገባቸዋል።

15 ስራ ላይ የሚገኙት ሰራተኞች የሥራ ስልጠና ላይ ለማግኘት ይገባቸዋል።

16 WpYpE WpYpE WpYpE YWJh qWw qYpE qWw (:XYpE) [W XpYpE] YpEYpE qYpE YWJh qWw qYpE qWw

17 :YpE-WpE YpEYpE WpE hYpE qYpE qYpE

18 :WpEh &WX-LE YXpEYpE-LE YpE qYpE WpE-WpE WpE qYpE

19 :JpYX WpEYpE LEpE-WpE WpE WpEh &WpE (p qYpE-WpE) [W -LE] [W -LE]

20 :WpEYpEh&E WpEh hWpE qYpE WpE YpE qYpE WpE

21 :WpEYpE XpE qYpE XpE WpE-WpE XpE YpE WpE XpE

22 :WpE WpE WpE-WpE YpEh WpE XpE XpE

23 :WpE WpE-WpE hWpE WpE WpEh WpE XpE XpE

24 :WpE WpE WpE-WpE XpE YpE WpE WpE WpE

:ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ 5

:ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ 6

:ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ 7

:ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ 8

:ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ 9

:ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ 10

:ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ 11

:ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ 12

:ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ ᐃᓕᓕᓄᓚ 13

- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23

:ሃህፃፍ ክፍፍ-ጃህ ህፅጸሃ ፃፃገ-ፈፅፅፅ ጃሃጃፈፈ 24

:ፃፃፃፍ ህፈፈፈፈ ፃፈፈፈ ህፅፅ ፅፅፅ ህፅፅ ህፅፅፅ 25

:ክፍፍ ህፈፈፈፈ ፃፈፈፈ ህፅፅ ህፅፅ ህፅፅ ህፅፅፅ ጃፃፃፅ 26

:ክፍፍ-ፈፈፈፈ-ፅፅ ህፅፅ ህፅፅ ህፅፅ ጃፃፃፅ ፃፃፃ 27

:ሃፈፈፈ ፈፈፈፈ ፈፈፈፈ ህፅፅ-ሃፈፈፈ ህፅፅ ፈፈፈፈ 28

:ጃፃፃፅ ህፈፈፈፈ ፈፈፈፈ ህፅፅ ህፈፈፈፈ ህፅፅፅፅ 29

:ክፍፍ-ፈፈፈፈ ህፅፅፅፅ ፅፅፅ (ፃ ፈፈፈፈ) [ህ ፈፈፈፈ] ፅፅፅ ህፅፅፅፅ 30

Proverbs 21

:ሃፈፈፈ ፈፈፈፈ ፈፈፈፈ-ፅፅ-ፅፅ ጃፃፃፅ-ፈፈፈፈ ህፅፅ-ፅፅ ህፅፅ-ፈፈፈፈ 1

:ጃፃፃፅ ህፅፅፅ ህፅፅፅ ህፅፅፅፅ ፈፈፈፈ ህፅፅ ህፅፅ-ህፅፅፅፅ 2

- 3 :ዳግማዊ ዳዊት ስርዓተ ግብርና ግብርና ግብርና ግብርና
- 4 :ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና
- 5 :ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና
- 6 :ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና
- 7 :ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና
- 8 :ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና
- 9 :ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና
- 10 :ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና
- 11 :ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና ግብርና

22 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ

23 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ

24 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ

25 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ

26 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ

27 :ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ

28 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ

29 (ᐱᐱᐱᐱᐱ) [ᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ] (ᐱᐱ ᐱᐱᐱᐱᐱ) [ᐱᐱ ᐱᐱᐱᐱᐱ] ᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ

30 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ

9 :ᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ

10 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ

11 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ

12 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ

13 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ

14 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ

15 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ

16 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ

17 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ

:טִּיפְיוֹת-לְעֵינַי יִשְׂרָאֵל וְיִשְׂרָאֵל וְיִשְׂרָאֵל וְיִשְׂרָאֵל וְיִשְׂרָאֵל 18

:אֵלֶּיךָ-יְיָ אֱלֹהֵינוּ וְיִשְׂרָאֵל וְיִשְׂרָאֵל וְיִשְׂרָאֵל וְיִשְׂרָאֵל 19

:אֲדַבֵּר אֲדַבֵּר (פ' אֲדַבֵּר) [אֲדַבֵּר] אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר 20

:אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר 21

:אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר 22

:אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר 23

:אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר 24

:אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר 25

:אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר 26

:אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר אֲדַבֵּר 27

28 :צַדִּיקֵי־לֵב יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם מִיָּד מוֹתֵתִים וְלֹא־יָדוּעִים יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם

29 :וְלֹא־יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם מִיָּד מוֹתֵתִים וְלֹא־יָדוּעִים יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם

Proverbs 23

1 :וְלֹא־יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם מִיָּד מוֹתֵתִים וְלֹא־יָדוּעִים יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם

2 :וְלֹא־יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם מִיָּד מוֹתֵתִים וְלֹא־יָדוּעִים יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם

3 :וְלֹא־יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם מִיָּד מוֹתֵתִים וְלֹא־יָדוּעִים יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם

4 :וְלֹא־יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם מִיָּד מוֹתֵתִים וְלֹא־יָדוּעִים יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם

5 :וְלֹא־יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם מִיָּד מוֹתֵתִים וְלֹא־יָדוּעִים יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם

:וְלֹא־יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם מִיָּד מוֹתֵתִים וְלֹא־יָדוּעִים יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם

6 :וְלֹא־יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם מִיָּד מוֹתֵתִים וְלֹא־יָדוּעִים יִשְׁמְרוּ אֶת־נַפְשָׁם

7 :שׁוֹמֵר לֹא יִגְדֹל יְצִיטוֹת לְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם

8 :וְעַל כֵּן יִשְׁמַר לְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם

9 :וְעַל כֵּן יִשְׁמַר לְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם

10 :וְעַל כֵּן יִשְׁמַר לְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם

11 :וְעַל כֵּן יִשְׁמַר לְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם

12 :וְעַל כֵּן יִשְׁמַר לְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם

13 :וְעַל כֵּן יִשְׁמַר לְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם

14 :וְעַל כֵּן יִשְׁמַר לְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם

15 :וְעַל כֵּן יִשְׁמַר לְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם וְלְעַלְמֵי עוֹלָם

16 :חֲבֵרָה שֶׁל אֲנִי מֵעַתָּה יִשְׁמַח בְּעֲשֵׂי אֱלֹהֵינוּ

17 :לֹא יִשְׁמַח בְּעֲשֵׂי אֱלֹהֵינוּ אֲנִי מֵעַתָּה יִשְׁמַח בְּעֲשֵׂי אֱלֹהֵינוּ

18 :אֲנִי מֵעַתָּה יִשְׁמַח בְּעֲשֵׂי אֱלֹהֵינוּ

19 :אֲנִי מֵעַתָּה יִשְׁמַח בְּעֲשֵׂי אֱלֹהֵינוּ

20 :אֲנִי מֵעַתָּה יִשְׁמַח בְּעֲשֵׂי אֱלֹהֵינוּ

21 :אֲנִי מֵעַתָּה יִשְׁמַח בְּעֲשֵׂי אֱלֹהֵינוּ

22 :אֲנִי מֵעַתָּה יִשְׁמַח בְּעֲשֵׂי אֱלֹהֵינוּ

23 :אֲנִי מֵעַתָּה יִשְׁמַח בְּעֲשֵׂי אֱלֹהֵינוּ

24 [ש לֹא] (פ לֹא) [ש לֹא] (פ לֹא) [ש לֹא] (פ לֹא)

:(פ לֹא) [ש לֹא] (פ לֹא)

:Xሂረገጃጃ ፩፻፲ ማግረሃ ጸሃ፳ ሂጃ፳ ማ፳፳፻ 33

:ግጃ ሠጃ፳፻ ፩፻፲ ማ፳፳፻ ማ፳፳፻ ጸ፳፳፻ 34

:፻፲ ሃ፳፳፻፳ ገ፳፳፻ ፳፳፻ ፳፳፻ ፳፳፻፳፻ ፳፳፻፳፻ ፳፳፻፳፻ ፳፳፻፳፻ ፳፳፻፳፻ 35

Proverbs 24

:፳፳፻ ጸሃ፳፻ (፩ ሃ፳፳፻) [ማ ሃ፳፳፻] -ግሂ ጃ፳፻ ፳፳፻፳፻ ጃ፳፻፳፻ 1

:፳፳፻፳፻ ማ፳፳፻፳፻ ማ፳፳፻ ማ፳፳፻ ፳፳፻፳፻ ፳፳፻፳፻ 2

:፳፳፻፳፻ ፳፳፻፳፻ ጸ፳፻ ፳፳፻ ፳፳፻፳፻ 3

:፳፳፻፳፻ ፳፳፻ ፳፳፻፳፻ ማ፳፻ ማ፳፻፳፻ ጸ፳፻፳፻ 4

:፳፻፳፻፳፻ ጸ፳፻፳፻፳፻ ፳፳፻፳፻ ማ፳፻፳፻፳፻ 5

:፳፻፳፻ ፳፳፻ ፳፳፻፳፻ ፳፳፻፳፻ ማ፳፻፳፻፳፻ ጸ፳፻፳፻፳፻ 6

7 :ሃጻገጋ-ቁጸጋገ ጵሪ ሰጦወፍ ጸሃጌጌቁ ርገሃጵሪ ጸሃጌጵፍ

8 :ሃጵፍፍገገ ጸሃጌጌጌ-ራጦፍ ሃሪ ጦፍጻሪ ፍወቁጌ

9 :ቦሪ ጌጎጵሪ ጸፍጦጸሃሃ ጸጵጸጵ ጸሪሃጵ ጸጌጌ

10 :ጻጌቁጌ ፍቦ ጻፍቦ ጌሃገፍ ጸገጋፍጸጻ

11 :ጌሃወቁጸ-ጌጵ ገፍጻሪ ጌገጸጌሃ ጸሃጌሪ ጌገቁፍሪ ርቦጻ

12 ክገፍገ-ጵሃጻ ጸሃፍሪ ክጌጸ-ጵሪጻ ጻፍ ሃክጦጎገ-ጵሪ ክጻ ፍጌጵጸ-ገጌ

:ሃሪጦጋጌ ጌጎጵሪ ፍገወጻሃ ጦጎገ ጵሃጻ ጌወጋክ ፍቦክሃ

13 :ጌጌቁ-ራጦ ፍሃጸጌ ጸጋክሃ ፍሃጸ-ገጌ ወፍጎ ገክፍ-ራጌጵ

14 :ጸፍጌጸ ጵሪ ጌጸሃፍጸሃ ጸገፍቁጵ ወገሃ ጸጵቦጌ-ጌጵ ጌወጋክ ጻጌጌቁ ጻጦጎ ክጌ

15 :ሂደቱ ለማረጋገጥ የሚያስፈልጉትን ሰነድ ለማግኘት ይረዳል

16 :የሰነድ ማረጋገጫ ለማድረግ የሚያስፈልጉትን ሰነድ ለማግኘት ይረዳል

17 :ሰነድ ለማረጋገጥ የሚያስፈልጉትን ሰነድ ለማግኘት ይረዳል (የሰነድ) [የሰነድ] ለማግኘት

18 :ሰነድ ለማረጋገጥ የሚያስፈልጉትን ሰነድ ለማግኘት ይረዳል

19 :ሰነድ ለማረጋገጥ የሚያስፈልጉትን ሰነድ ለማግኘት ይረዳል

20 :ሰነድ ለማረጋገጥ የሚያስፈልጉትን ሰነድ ለማግኘት ይረዳል

21 :ሰነድ ለማረጋገጥ የሚያስፈልጉትን ሰነድ ለማግኘት ይረዳል

22 :ሰነድ ለማረጋገጥ የሚያስፈልጉትን ሰነድ ለማግኘት ይረዳል

23 :ሰነድ ለማረጋገጥ የሚያስፈልጉትን ሰነድ ለማግኘት ይረዳል

24 :ሰነድ ለማረጋገጥ የሚያስፈልጉትን ሰነድ ለማግኘት ይረዳል

25 :ግሃጵ-አገግ ልሃግ ሕጻጽ ሕጻን ሕጻን ሕጻን ሕጻን

26 :ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን

27 :ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን

28 :ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን

29 :ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን

30 :ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን

31 :ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን

32 :ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን

33 :ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን ሕጻን

9 :לרז-לז ררז נררר ררר-רר ררר ררר

10 :רררר רר ל ררררר ררר רררר-רר

11 :ררררר-לר ררר ררר ררר רררר ררר ררר ררר

12 :רררר ררר-לר ררר רררר ררר ררר-ררר ררר ררר

13 :רררר ררררר רררר רררר רררר ררר ררר ררר ררר-ררר

14 :ררר-ררר ררר ררר ררר ררר ררר ררר ררר

15 :ררר-ררר ררר ררר ררר ררר ררר ררר

16 :ררררר רררר-רר ררר ררר ררר ררר ררר

17 :רררר ררר-רר ררר ררר ררר ררר ררר

- 18 :90W 70 Y3099 300 W1X 0Y0W 100 9900 100
- 19 :300 0000 7000 0000 X0000 0000 300 000
- 20 :00-00 00 00000 900 900-00 100 300 0000 700 3000
- 21 :000 Y0000 000-000 000 Y00000 000 900-00
- 22 :00-0000 00000 Y0000-00 300 300 00000 00
- 23 :900 0000 000000 00000 000 00000 0000 000
- 24 :900 X000 (0 00000) [0 00000] X000 00-000-00 X00 900
- 25 :0000 1000 3000 000000 3000 W00-00 0000 000
- 26 :000-0000 00 0000 X000 90000 W000 000
- 27 :7000 0000 9000 900-00 X0000 W00 000

:ሃዳሃባ ሰጠኝ ክፈፍ ሰጠኝ ሰጠኝ ሰጠኝ ሰጠኝ ሰጠኝ ሰጠኝ 28

Proverbs 26

:ጥላታ ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር 1

:ጥላታ (ጥ ስ) [ጥ ስ] ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር 2

:ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር 3

:ጥላታ-ስጥጥር ስጥጥር-ስጥጥር ስጥጥር-ስጥጥር ስጥጥር-ስጥጥር ስጥጥር-ስጥጥር 4

:ስጥጥር ስጥጥር ስጥጥር-ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር 5

:ስጥጥር-ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር 6

:ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር 7

:ጥላታ ስጥጥር ስጥጥር-ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር ስጥጥር 8

ግንባታ ስራ ለሰራተኛው ሰው-ግንባታ ስራ ስራ	9
ግንባታ ስራ ለሰራተኛው ሰው ስራ ስራ	10
ግንባታ ስራ ለሰራተኛው ሰው ስራ ስራ	11
ግንባታ ስራ ለሰራተኛው ሰው ስራ ስራ	12
ግንባታ ስራ ለሰራተኛው ሰው ስራ ስራ	13
ግንባታ ስራ ለሰራተኛው ሰው ስራ ስራ	14
ግንባታ ስራ ለሰራተኛው ሰው ስራ ስራ	15
ግንባታ ስራ ለሰራተኛው ሰው ስራ ስራ	16
ግንባታ ስራ ለሰራተኛው ሰው ስራ ስራ	17

:Xሂሂሂ ሕዝቅ ሕዝቅ ገደብ ገደብ ገደብ	18
:ክፍል ስድስት-ገደብ ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት	19
:ሁለት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት	20
:ገደብ-ገደብ (ገደብ ስድስት) [ስድስት ስድስት] ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት	21
:ገደብ-ገደብ ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት	22
:ገደብ-ገደብ ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት	23
:ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት (ገደብ ስድስት) [ስድስት ስድስት]	24
:ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት	25
:ገደብ ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት ስድስት	26

8 :ሃገራዊ ጥበቃና ጥቅም ለማረጋገጥ የሚያስፈልጉትን ጥረትና ጥረት ያደርጋል

9 :የሀገራዊ ጥበቃና ጥቅም ለማረጋገጥ የሚያስፈልጉትን ጥረትና ጥረት ያደርጋል

10 ለሀገራዊ ጥበቃና ጥቅም ለማረጋገጥ የሚያስፈልጉትን ጥረትና ጥረት ያደርጋል

:የሀገራዊ ጥበቃና ጥቅም ለማረጋገጥ የሚያስፈልጉትን ጥረትና ጥረት ያደርጋል

11 :የሀገራዊ ጥበቃና ጥቅም ለማረጋገጥ የሚያስፈልጉትን ጥረትና ጥረት ያደርጋል

12 :የሀገራዊ ጥበቃና ጥቅም ለማረጋገጥ የሚያስፈልጉትን ጥረትና ጥረት ያደርጋል

13 :የሀገራዊ ጥበቃና ጥቅም ለማረጋገጥ የሚያስፈልጉትን ጥረትና ጥረት ያደርጋል

14 :የሀገራዊ ጥበቃና ጥቅም ለማረጋገጥ የሚያስፈልጉትን ጥረትና ጥረት ያደርጋል

15 :የሀገራዊ ጥበቃና ጥቅም ለማረጋገጥ የሚያስፈልጉትን ጥረትና ጥረት ያደርጋል

:&991 Y5111 5WY 4Y9-511 3111 16

:Y309-111 141 W1&Y 141 1999 199 17

:1911 Y111& 9WY 3191 11&1 3&X 911 18

:11&1 11&1-91 51 11111 11111 11111 19

:3109WX &1 11&1 11111 3109WX &1 (9 Y19&Y) [1 319&Y] 1Y&W 20

:Y1111 111 W1&Y 9311 9Y1Y 1111 1111 21

1109 XY1193 1YX9 WX1119 11Y&1-X&-WYX1X 1& 22

:YX1Y& Y1101 9Y1X-&1

:1119111 191 X1W 11&1 111 11&X 111 23

(:9Y1Y) [1 9Y1] 9Y11 911-1&Y 511 11Y11 &1 11 24

- 7 :ሃይማኖት ማህበራዊ ማህበራዊ ጥያቄዎችን ለማሟላት ማድረግ ይቻላል
- 8 :ሃይማኖት ማህበራዊ ማህበራዊ (የ ሃይማኖት) [የ ሃይማኖት] ማህበራዊ ማህበራዊ ጥያቄዎችን ለማሟላት ማድረግ ይቻላል
- 9 :ሃይማኖት ማህበራዊ ማህበራዊ ጥያቄዎችን ለማሟላት ማድረግ ይቻላል
- 10 :ሃይማኖት ማህበራዊ ማህበራዊ ጥያቄዎችን ለማሟላት ማድረግ ይቻላል
- 11 :ሃይማኖት ማህበራዊ ማህበራዊ ጥያቄዎችን ለማሟላት ማድረግ ይቻላል
- 12 :ሃይማኖት ማህበራዊ ማህበራዊ ጥያቄዎችን ለማሟላት ማድረግ ይቻላል
- 13 :ሃይማኖት ማህበራዊ ማህበራዊ ጥያቄዎችን ለማሟላት ማድረግ ይቻላል
- 14 :ሃይማኖት ማህበራዊ ማህበራዊ ጥያቄዎችን ለማሟላት ማድረግ ይቻላል
- 15 :ሃይማኖት ማህበራዊ ማህበራዊ ጥያቄዎችን ለማሟላት ማድረግ ይቻላል

16 :ህዝብ ህዝብ ስጦት (የ ልዩ) [ህ ደህን] ለህዝብ ግን ለህዝብ ግን ለህዝብ ግን

17 :ህዝብ ህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት

18 :ህዝብ ህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት

19 :ህዝብ ህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት

20 :ህዝብ ህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት

21 :ህዝብ ህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት

22 :ህዝብ ህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት

23 :ህዝብ ህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት

24 :ህዝብ ህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት

25 :ህዝብ ህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት ለህዝብ ስጦት

:ጩጩ ልሃታ ጃጃጃጃ ማረጋገጥ ለገገገ ልሃታ ሃገሪ ጃጃጃ 26

:ጸሃጸጸ-ጸጸ ሃገገገ ጩጩ ጸጸጸጸ ገገገ ጸጸ ጸጸጸ 27

:ጩጩጩ ሃገገገ ጩጩጩ ጩጩ ጸጸጸ ጩጩጩ ጩጩጩ 28

Proverbs 29

:ጸጸጸ ገገገ ጸጸጸ ጩጩ ጩጩ ጩጩ-ጩጩ ጸጸጸጸ ጸጸጸጸ ጸጸጸ 1

:ጩጩ ገገገ ጩጩ ጩጩ ጩጩ ጩጩ ጩጩ ጩጩጩ ጸጸጸጸ 2

:ጸጸጸ-ጩጩ ጸጸጸጸ ጩጩ ጩጩ ጩጩ ጩጩ ጩጩ-ጩጩ 3

:ጩጩጩ ጸጸጸጸ ጩጩ ጩጩ ጩጩ ጩጩ ጩጩጩ ጩጩጩ 4

:ጩጩጩ-ጩጩ ጩጩጩ ጩጩ ጩጩጩ ጩጩጩ ጩጩጩ 5

:ጩጩጩ ጩጩጩ ጩጩጩ ጩጩጩ ጩጩ ጩጩ ጩጩጩ 6

:Xᐃᐅ ክፉፉ-ᐃᑦ ᐃᐃᑦ ᐃᑦᑦᐅ ክፉᐅ ᑦፅᐅᑦ ᐃᐅᑦ	7
:ᑕᐃ ᐃᑦᑦᐅᑦ ᐃᑦᐃᐃᐃᐃᐃ ᐃᑦᑦᑦ ᐃᑦᑦᑕᑦ ክፉᑦ ᑦᐃᑦ	8
:Xᑦᑦ ክፉᐃᐃ ᑦᑦᐃᐃ ᑦᑦᑦᑦ ᑕᑦᐃᐃ ᐃᑦᐃ-Xᐃ ᐃᑕᐃᑦ ᐃᐃᐃ-ᐃᑦᐃ	9
:ᐃᐃᑕᑦ ᐃᐃᑦᑦᑦ ᐃᑦᑦᐃᐃᐃ ᐃᐃᐃ-ᐃᑦᐃᐃᐃ ᐃᑦᐃᐅ ᑦᐃᑦᐃ	10
:ᐃᑦᑦᐃᐃᐃ ᑦᐃᑦᐃᐃ ᐃᐃᐃᐃ ᑕᑦᑦᐃ ᐃᑦᑦᐃᐃ ᐃᑦᐃᐃᐃ-ᐃᐃ	11
:ᐃᑦᐃᐃᐃ ᐃᑦᐃᐃᐃᐃ-ᐃᐃ ᑦᑦᐃᐃᐃ-ᑕᑦᑦ ᑦᑦᐃᐃᐃ ᑕᐃᐃ	12
:ᐃᐃᐃᐃ ᐃᑦᑦᐃᐃ ᑦᑦᑦᑦ-ᑦᑦᐃᐃᐃ ᐃᐃᑕᑦᑦ ᐃᑦᐃᐃᐃᐃ ᐃᑦᐃᐃ ᐃᑦᑦ	13
:ᑦᐃᐃᐃ ᐅᑦᑕ ᐃᑦᑦᐃ ᐃᑦᑦᐅ ᐃᐃᐃᐃ ᐃᑕᐃᐃ ᐃᐃᐃ	14
:ᐃᐃᐃ ᐃᑦᑦᐃ ᑦᑦᐃᐃ ᑦᑦᑦᑦ ᐃᐃᐃᐃ ᑦᐃᐃ ᐃᑦᐃᐃᐃᐃ ᐃᑦᐃ	15

16 :Y&91 WXLJW9 W1P1V1Y 0WJ-3991 W10W9 XY999

17 :WJL W1hV0W hX1Y Wq1h1Y W99 991

18 :Y39W& 39YX 9W9Y W0 09J1 hYqk h1&9

19 :3h0W h1&Y h191-1W V90 99Y1-&L W199V9

20 :YhW W1qW L1qW 3Y9X Y199V9 1& W1& X1qk

21 :hYh W133 YX19k&Y YV90 90hW 9hJW

22 :0WJ-99 3Wk 00Y hYVW 3991 J&-W1&

23 :VY9W W1X1 kY9-LJWY Yh1JWX WV& XY&7

24 :V171 &LY 0W1 3L& YWJh &hYW 9h7-W0 9LYk

25 ገጠሞችን ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ

26 ለሌሎች ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ

27 ለሌሎች ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ

Proverbs 30

1 ለሌሎች ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ

2 ለሌሎች ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ

3 ለሌሎች ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ

4 ለሌሎች ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ

ገጠሞችን ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ

5 ለሌሎች ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ ለሌሎች ጥገና ለማድረግ

:X᠑᠙ᠮᠴᠠ ᠮᠴ ᠬᠢᠴᠢᠰᠢ-ᠰᠠ ᠶᠢᠶ᠑᠑ᠳ-᠘᠐ ᠵᠢᠶᠶᠶᠶ-᠘ᠶ 6

:Xᠶᠶᠶᠶ ᠮᠴ᠑᠑᠑ ᠰᠢᠶᠶᠶ ᠰᠢᠶᠶᠶᠶ-᠘ᠶ ᠮᠴᠶᠶᠶ ᠰᠢᠶᠶᠶᠶ ᠮᠴᠶᠶᠶ 7

:ᠰᠢᠶᠶᠶ ᠮᠴᠶᠶ ᠰᠢᠶᠶᠶᠶᠶᠶᠶ ᠰᠢᠶᠶᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶ 8

ᠰᠢᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶ ᠰᠢᠶᠶᠶᠶᠶᠶ ᠰᠢᠶᠶᠶᠶᠶᠶ ᠰᠢᠶᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶᠶ 9

:ᠰᠢᠶᠶᠶᠶ ᠮᠴ ᠰᠢᠶᠶᠶᠶᠶᠶ

:Xᠶᠶᠶᠶᠶ ᠮᠴᠶᠶᠶᠶᠶᠶᠶ (ᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶᠶ) [ᠮᠴ ᠶᠶᠶᠶᠶᠶᠶ] -᠘ᠶ ᠶᠶᠶᠶᠶ ᠰᠢᠶᠶᠶᠶᠶᠶᠶ 10

:ᠮᠴᠶᠶᠶ ᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶᠶ 11

:ᠶᠶᠶᠶ ᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶᠶᠶ 12

:ᠶᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶᠶᠶᠶ ᠶᠶᠶᠶᠶᠶᠶᠶᠶ 13

14 ስጋት ማጠቃለያ ለሚደረግ ስራ ለሚደረግ ስራ ለሚደረግ ስራ ለሚደረግ ስራ

:ስጋት ማጠቃለያ

15 ስጋት ማጠቃለያ ለሚደረግ ስራ ለሚደረግ ስራ ለሚደረግ ስራ ለሚደረግ ስራ

:ስጋት ማጠቃለያ

16 ስጋት ማጠቃለያ ለሚደረግ ስራ ለሚደረግ ስራ ለሚደረግ ስራ ለሚደረግ ስራ

17 ስጋት ማጠቃለያ ለሚደረግ ስራ ለሚደረግ ስራ ለሚደረግ ስራ ለሚደረግ ስራ

18 ስጋት ማጠቃለያ ለሚደረግ ስራ ለሚደረግ ስራ ለሚደረግ ስራ ለሚደረግ ስራ

19 ስጋት ማጠቃለያ ለሚደረግ ስራ ለሚደረግ ስራ ለሚደረግ ስራ ለሚደረግ ስራ

:ስጋት ማጠቃለያ

20 ስጋት ማጠቃለያ ለሚደረግ ስራ ለሚደረግ ስራ ለሚደረግ ስራ ለሚደረግ ስራ

:X&W ረሚሃ-ጵሪ ሳግጶጵ ጸዳጸሃ ሱጻጵ ጃጥጥ ሠሂሪ ጸዳጸ 21

:ሠዳሪ-ሳግጠገ ገሠ ረግጸሃ ሠሂሪግገ ገሠ ልግግ-ጸዳጸ 22

:ጃጸግግ ሠግገጸ-ገሠ ጃዳጋሠሃ ረግጸ ገሠ ጃጵሃጸ ጸዳጸ 23

:ሠገግሠዳግ ሠገግሠዳ ጃግጃሃ ሱጻጵ-ገጸጸግ ሠገ ጃግግጸ 24

:ሠሠዳሪ ሱገግግ ሃጸገግገሃ ግግ-ጵሪ ሠግ ሠገሪግጸገ 25

:ሠጸገግ ሳሪገግ ሃግገግገሃ ሠሂሱ-ጵሪ ሠግ ሠገገግ 26

:ሃሪግ ሱገዳ ጵሱገሃ ጃግጸጵ ጸገጵ ሠሪግ 27

:ሠሪግ ገሪግገገግ ጵገገገሃ ሠጋጸጸ ሠገግገግ ጸገግግ 28

:ጸሠሪ ገግጸገግ ጃግግጸሃ ልግግ ገግጸገግ ጃግግ ጃግግ 29

30 ለሆኑት ግሃወቱ-አረሃ ጃጃጃጃ ግሃግግ ወቅሪ

31 ሃጃጃ ጃጃጃ ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት

32 ጃጃጃ ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት

33 ግሃግ ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት

Proverbs 31

1 ሃጃጃ ሃጃጃጃ-ግሃጃ ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት

2 ግሃግግ-ግሃ ጃጃጃ ግሃግግ-ግሃ-ጃጃጃ ግሃግግ-ግሃ

3 ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት

4 ግሃግ (ግ ግ) [ሆ ሃ] ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት

5 ግሃግ-ግሃግ-ሆ ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት ለሆኑት

:Wጋኔ ተግባር ክብሩ ለግሩፍ ገጠራ-ሃገር 6

:ግሩፍ-ገጠራ ለ ሃገራዊ ሃይማኖት ግሩፍ ገጠራ 7

:ግሩፍ ገጠራ-ግሩፍ ገጠራ ግሩፍ ገጠራ 8

:ግሩፍ ገጠራ ገጠራ ገጠራ ገጠራ-ግሩፍ ገጠራ 9

:ግሩፍ ገጠራ ገጠራ ገጠራ ገጠራ ገጠራ-ግሩፍ ገጠራ 10

:ግሩፍ ገጠራ ገጠራ ገጠራ ገጠራ ገጠራ 11

: ግሩፍ ገጠራ ገጠራ ገጠራ ገጠራ ገጠራ 12

:ግሩፍ ገጠራ ገጠራ ገጠራ ገጠራ ገጠራ 13

:ግሩፍ ገጠራ ገጠራ ገጠራ ገጠራ ገጠራ 14

- 15 :ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ
- 16 :ᐱᐱᐱᐱᐱᐱ (ᐱ ᐱᐱᐱᐱ) [ᐱ ᐱᐱᐱᐱ] ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ
- 17 :ᐱᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ
- 18 :ᐱᐱᐱᐱ (ᐱ ᐱᐱᐱᐱᐱ) [ᐱ ᐱᐱᐱᐱᐱ] ᐱᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ
- 19 :ᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱ
- 20 :ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ
- 21 :ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ
- 22 :ᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ
- 23 :ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ
- 24 :ᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱ ᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱᐱ

ግል-ገቢዎች ለግብርና ገቢዎች ለግብርና ገቢዎች ገቢዎች 25

ግብርና ገቢዎች ለግብርና ገቢዎች ለግብርና ገቢዎች 26

ግብርና ገቢዎች ለግብርና ገቢዎች ለግብርና ገቢዎች 27

ግብርና ገቢዎች ለግብርና ገቢዎች ለግብርና ገቢዎች 28

ግብርና ገቢዎች ለግብርና ገቢዎች ለግብርና ገቢዎች 29

ግብርና ገቢዎች ለግብርና ገቢዎች ለግብርና ገቢዎች 30

ግብርና ገቢዎች ለግብርና ገቢዎች ለግብርና ገቢዎች 31